



# ગુજરાત જાહેર સેવા આયોગ

## અગત્યની જાહેરાત

### નાયબ સેક્શન અધિકારી વર્ગ-૩ અને નાયબ મામલતદાર વર્ગ-૩

(જાહેરાત ક્રમાંક: ૫૫/૨૦૧૮-૧૯) ની પ્રિલિમિનરી પરીક્ષા

GPSC દ્વારા નાયબ સેક્શન અધિકારી વર્ગ-૩ અને નાયબ મામલતદાર વર્ગ-૩ (જાહેરાત ક્રમાંક: ૫૫/૨૦૧૮-૧૯) ની પ્રિલિમિનરી પરીક્ષા તા. ૧૬/૧૨/૨૦૧૮ ના રોજ રાજ્યના ૩૨ જિલ્લામાં, ૧૪૫૨ પેટા કેન્દ્રો ખાતે યોજવામાં આવનાર છે. પ્રશ્નપત્ર ( સામાન્ય અભ્યાસ) બપોર બાદ ૦૩.૦૦ થી ૦૫.૦૦ દરમિયાન લેવામાં આવશે.

પરીક્ષા આપનાર ઉમેદવારોને નીચે મુજબ વિશેષ સૂચનાઓ આપવામાં આવે છે:

૧. પરીક્ષા શરૂ થવાના અડધા કલાક પહેલા એટલે કે બપોરે - ૦૨.૩૦ કલાકે ઉમેદવારોને પરીક્ષાખંડમાં પ્રવેશ આપવામાં આવશે. ઉમેદવારોએ સમય મર્યાદામાં જ પરીક્ષા ખંડમાં બેસી જવું. ઉમેદવારે પોતાના જ બેઠક નંબર ઉપર સ્થાન લેવું. પ્રવેશપત્ર તા. ૧૬/૧૨/૨૦૧૮ ના રોજ બપોરે ૦૩.૦૦ કલાક સુધી જ ડાઉનલોડ કરી શકાશે.

૨. ઉમેદવારે પ્રવેશ પત્ર અને લખાણ માટે પેન સિવાય અન્ય કોઈ પણ ચીજ વસ્તુ જેવી કે મોબાઇલ, કેલક્યુલેટર કે અન્ય કોઈ પણ જાતનું ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ સાથે રાખવાનું નથી. જો કોઈ ઉમેદવાર ઉપરોક્ત ઉપકરણો સાથે પકડાશે તો તેમની ઉમેદવારી રદ કરવામાં આવશે અને આયોગના નિયમો અનુસાર શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરૂપે આયોગ દ્વારા લેવાનાર ભવિષ્યના ભરતી પ્રસંગો માટે પણ ગેરલાયક ઠેરવવામાં આવશે તેમજ ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે.

૩. ઉમેદવારને એક જ જવાબવહી આપવામાં આવશે. જવાબવહી પર પ્રિન્ટ થયેલ નંબર અને ઉમેદવારનો બેઠક નંબર સમાન છે, તે ઉમેદવારે ચકાસી લેવું. પ્રવેશ મેળવ્યા બાદ ઉમેદવારે ઇન્વીજીલેટર દ્વારા અપાતી સૂચનાનું કાળજીપૂર્વક પાલન કરવું. OMR શીટ મળ્યા બાદ તેનો ચીવટથી અભ્યાસ કરવો અને પોતાનું નામ, બેઠક નંબર, પ્રશ્નપત્રની સીરીઝ, પરીક્ષા કેન્દ્રના શહેરનું નામ, પરીક્ષાની તારીખ, પરીક્ષાનું નામ અને પોતાની જન્મ તારીખ વિગેરે બાબતો સાથે ઉમેદવારે પોતાની સહી કરવી તેમજ ઇન્વીજીલેટરની સહી કરાવવી. જો ઉમેદવારે જવાબવહીમાં સહી નહી કરી હોય તો, તેવી જવાબવહી તપાસવામાં આવશે નહીં.

૪. ઉમેદવારે કાળી કે વાદળી બોલપેનથી કાળજીપૂર્વક કોડીંગ કરવું. એક વખત કરેલ કોડીંગ સુધારી શકાશે નહિ. તે માટે છેકછાક કરવી નહી કે વ્હાઇટનર જેવી વસ્તુનો ઉપયોગ કરવો નહીં. જો કોઈ પણ સંજોગોમાં ઉમેદવાર વ્હાઇટનર કે કરેક્શન ઇન્ક જેવી વસ્તુનો ઉપયોગ કરશે તો તેવા ઉમેદવારની OMR જવાબવહી તપાસવામાં આવશે નહીં.

૫. ઉમેદવારે જવાબવહીમાં રોલ નંબર કે પ્રશ્નપત્ર પુસ્તિકાની સીરીઝ કે પ્રશ્નપત્ર પુસ્તિકાનો નંબર ખોટો લખેલ હશે કે ખોટો એન્કોડ કરેલ હશે તો તે જવાબવહી પણ તપાસવામાં આવશે નહીં.

૬. પરીક્ષા શરૂ થયાથી પૂરી થાય ત્યાં સુધી શાંતિથી પરીક્ષા આપવી; કોઈ પણ પ્રકારની ચોરી કે ગેરરીતિ કરવી નહિ; વાતચીત કરવી નહિ કે મેસેજ આપલે કરવા નહીં. જો તેમ કરતા કોઈ ઉમેદવાર પકડાશે તો સખ્ત પગલાં લેવામાં આવશે. OMR શીટ વાળવી નહિ; કરચલી ન પડે તે માસ જોવું. જવાબવહીને પીન, ટાંકણી કે દોરો બાંધવો નહિ. ઉમેદવારે પરીક્ષા પૂર્ણ થયેથી OMR શીટ ઇન્વીજીલેટરને અચૂક જમા કરવાની રહેશે. કોઈ પણ ઉમેદવારને પરીક્ષા પૂર્ણ થાય તે પહેલાં વર્ગ ખંડ છોડવાની પરવાનગી આપવામાં આવશે નહિ. અસાધારણ સંજોગોમાં ઉમેદવારને વર્ગખંડ છોડવાની ફરજ પડે તેવા સંજોગોમાં પ્રશ્નપત્ર સહિત અન્ય પરીક્ષા સાહિત્ય ઇન્વીજીલેટરને પરત જમા કરાવ્યા બાદ જ પરીક્ષા ખંડ છોડવાની પરવાનગી આપવામાં આવશે.

૭. લખાણ શરૂ કરતા પહેલા પ્રશ્નપુસ્તિકા તપાસી લેવી.; જો પ્રશ્નપુસ્તિકા ખામીવાળી હોવાની જાણ થાય તો તુરત જ બદલી આપવા ઇન્વીજીલેટરને વિનંતી કરવી. પરીક્ષા પૂરી થયા બાદ ઉમેદવાર પ્રશ્નપત્ર લઇ જઇ શકશે. ઉમેદવારે રફ કામ માટે અલગ રફ શીટ ન માંગવું પરંતુ પ્રશ્નપત્ર માં જ રફ કામ કરવું.

૮. આ પ્રશ્નપત્રના બધા પ્રશ્નો હેતુલક્ષી છે. દરેક પ્રશ્નના ઉત્તરમાં A, B, C, D વિકલ્પો આપેલાં છે. OMR જવાબવહીમાં E વિકલ્પ છે. E વિકલ્પ "Not attempted" અંગેનો રહેશે. જો ઉમેદવાર પ્રશ્નનો જવાબ આપવા ના ઇચ્છતા હોય તે આ વિકલ્પ પસંદ કરી શકશે. અને "Not attempted " વિકલ્પ પસંદ કરવાના કિસ્સામાં નેગેટીવ માર્કિંગ લાગુ પડશે નહીં. તેથી ઉમેદવારે સાચો વિકલ્પ શોધી જવાબવહી (OMR Answer Sheet) માં સંબંધિત પ્રશ્નના ક્રમ સામે આપેલ A, B, C, D કે E ના વર્તુળને પૂરેપૂરું ભૂરી / કાળી શાહીની બોલપેનથી ડાર્ક કરવું.

૯. આ કસોટીમાં પ્રત્યેક ખોટા જવાબ, એકથી વધુ જવાબના કિસ્સામાં તથા એક પણ વિકલ્પ એનકોડ નહીં કરવાના કિસ્સામાં જે તે જવાબના નિશ્ચિત ગુણના ૦.૩ ગુણ મેળવેલ ગુણમાંથી કાપવામાં આવશે. એટલે કે ખોટા જવાબો માટે નેગેટીવ ગુણની બાબત ઉમેદવારે ધ્યાને રાખવાની રહેશે.

૧૦. પરીક્ષા સંચાલનના ઉચ્ચ માપદંડોને અનુસરવા તમામ પગલાં લેવામાં આવેલ છે. જેથી કોઈ પણ ઉમેદવારે ઉમેદવારોની લાગણી તથા પ્રક્રિયા અને પદ્ધતિની અને ગોપનિયતાના ધોરણોની સમજણના અભાવે ગેરલાભ ઉઠાવતા લેભાગુ તત્વોની શેઠમાં આવ્યા વિના પોતાની મહેનત અને ક્ષમતા આધારે પરીક્ષા આપવા અનુરોધ કરવામાં આવે છે. જો કોઈ તત્વો ઉમેદવારોને પ્રભાવિત કરી નાણાં ની માંગણી કરે તો તે અંગે તાત્કાલિક લાંચ રૂશવત વિરોધી બ્યુરોને જાણ કરવી.

૧૧. સીધી કે આડકતરી રીતે પરીક્ષામાં સફળ થવા ઉમેદવારે કોઈ વગ વાપરવાનો કે ગેરકાયદેસર પ્રયાસ કરવો નહિ. કોઈ ઉમેદવાર, કોઈ પણ પ્રકારની ગેરરીતિ કરતા માલુમ પડશે તો તેને આયોગની ભરતી પરીક્ષામાં ચોક્કસ સમય માટે કે કાયમ માટે ગેરલાયક ઠેરવવા સહિતની દંડનીય કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેવી.

૧૨. ઉમેદવારોએ ફક્ત પ્રવેશપત્ર અને ઉમેદવારોની સૂચનાઓ ( પરીશિષ્ટ - ૧ અને ૨ ) જ ડાઉનલોડ કરવાના રહે છે.

**ઉમેદવારોને આ સૂચનાઓનું ચુસ્ત પાલન કરવા જણાવવામાં આવે છે.  
ગુજરાત જાહેર સેવા આયોગ તમામ ઉમેદવારોને શુભેચ્છા પાઠવે છે.**